



1st August, 2022

To

BSE Limited

The Deputy Manager (Listing - CRD),
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street
Mumbai - 400 001

Scrip Code: 533151

ISIN: INE950I01011

The National Stock Exchange of India Limited

The Manager (Listing Department),
Exchange Plaza, C-1, Block G,
Bandra Kurla Complex, Bandra (E)
Mumbai - 400 051

Symbol: DBCORP

Sub.: Compliance under Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ["SEBI Listing Regulations"]

Ref: Newspaper Advertisement - Unaudited Financial Results of the Company for Q1 FY 2022-23 ended on 30th June, 2022

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of the SEBI Listing Regulations, please find enclosed herewith the Newspaper Advertisements in respect of the Unaudited Financial Results of the Company for Q1 FY 2022-23 ended on 30th June, 2022 published in the following newspapers:

1. Financial Express (English – All India Editions) – 29th July, 2022; and
2. Divya Bhaskar (Gujarati – Ahmedabad Edition) – 30th July, 2022.

This intimation is also being uploaded on the Company's website i.e. www.dbcorpltd.com.

Thanking you.

Yours truly,

For D. B. Corp Limited

Anita Gokhale
Company Secretary

Membership Number: F4836



Encl.: as above



India's Largest Newspaper Group | 12 States | 64 Editions | 3 Languages

Registered Office :

Plot No. 280, Sarkhej-Gandhinagar Highway,
Near YMCA Club, Makarba,
Ahmedabad - 380 051, Gujarat

Corporate Office :

501, 5th Floor, Naman Corporate Link,
Opp. Dena Bank, C-31, G Block,
Bandra Kurla Complex, Bandra (East),
Mumbai - 400 051, Maharashtra

D. B. Corp Limited

CIN: L22210GJ1995PLC047208

Website: www.dbcorpltd.com

Email: dbcs@dbcorp.in

Tel.: +91 22 7157 7000 Fax: +91 22 7157 7093

જેકેટ-4નું અનુસંધાન ...5 વર્ષમાં

અભ્યાસ કે નોકરી માટે ભારતીયોની પહેલી પસંદ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા છે. હાલમાં 1૩ લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ બીજા દેશોમાં અભ્યાસ કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ મુર્મુને...

કરું છું. નોંધનીય છે કે ભુષવારે વિજય ચોકમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ચોધરીએ રાષ્ટ્રપતિ મુર્મુ માટે વિવાદાસ્પદ નિવેદન કર્યો હતો જે બાદ સત્તારૂઢ ભાજપના સાંસદોએ આ મુદ્દાને ઊંઘવતા અધીર રંજન અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી માફી માગે તેવી માગ કરી હતી.

ગોલ્ડન ‘ગિફ્ટ’...

પણ શુભારંભ થઈ રહ્યો છે અને નેશનલ સ્કોક એક્સચેન્જ ઈન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસીસ સેન્ટર અને સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ ત્રણેયનું જોડાણ થઈ રહ્યું છે. મોદીએ આ ગિફ્ટ સિટીમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભારતની રીજનલ ઓફિસ, ત્રણ ફોરેન બેંક, ચાર નવા ઈન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસીસ પ્લેટફોર્મના શુભારંભ તેમજ ગિફ્ટ સિટીમાં કાર્પરેટ પાંચ ફિનટેક કોમ્પ્સને ઓથોરિટી સર્ટિફિકેટ આપવાના અવસરે 100થી વધારે બ્રોકર ડીલરને કાર્યરત કરવાના તેમજ ઈન્ડિયા આઈએનએક્સમાં 75થી વધારે બોન્ડ લિસ્ટિંગ કરાવ્યું હતું.

વડાપ્રધાને જણાવ્યું કે, જાન્યુઆરી 201૩માં ગિફ્ટ સિટી માત્ર ગુજરાતની સોથી ઊંચી ઇમારત તરીકેની ઓળખ ધરાવતી હતી. ગિફ્ટ સિટી એ એવો વિચાર છે જે તેના સમયથી ઘણો આગળ હતો. વર્ષ 2008માં સમગ્ર વિશ્વ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો અને મંદીનો સમય હતો ત્યારે દુર્ભાગ્ય એ હતું કે આવી અનિશ્ચિતતાઓના માહોલમાં ભારતનું પ્રતિનિધિત્વ નબળા હાથોમાં હતું. પરંતુ, ત્યારે પણ ગુજરાત ફાઇનાન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા અને વિશાળ પગલા ભરી રહ્યું હતું. એ વખતે આવેલા ગિફ્ટ સિટીના વિચારે આજે વાણિજ્ય અને ટેકનોલોજીમાં મજબૂત ઓળખ ઊભી કરી છે. કેન્દ્રીય નાણામંત્રી

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, નાણાંકીય સહિત અન્ય ક્ષેત્રમાં ભારતમાં આજે પ્રગતિ થઈ છે ત્યારે બેન્કિંગ સેક્ટરમાં છેલ્લાં બે વર્ષમાં કુલ સંપત્તિ બમણી થઈને ૩2 બિલિયન યુએસ ડૉલર થઈ ગઈ છે. ફંડસ (ઈક્વિટી ફંડસ)માં સમાન રીતે દરેક વ્યક્તિ આ અધિકારક્ષેત્ર તરફ જોઈ રહ્યા છે જેમાં રોકાણ કરી શકાય છે. અને છેલ્લા બે વર્ષથી ભારત સરકારના નાણા મંત્રાલયે ગિફ્ટ સિટીમાં સક્રિયપણે કામ કર્યું છે. ભારત જ્યારે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 25 વર્ષની પ્રગતિ માટેનું વિઝન નક્કી કર્યું છે.

આપની ટિકિટ...

અરજદારનાં નિવેદનમાં તે માનસિક બીમાર હોવાનું, સ્વભાવે શંકાશીલ હોવાનું અને 6 માસથી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો હોવાનું તેમજ આમ આદમી પાર્ટીના તેમના સાથી કાર્યકર બાબુભાઈ ગઢવી અને કોદરભાઈ ખાંટ દ્વારા ટિકિટ અપાવવાની લાલચમાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ અરજી કરાવી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસને જણાવ્યું છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, અરજીની ગંભીરતા જોતા પોલીસે અરજદાર હિતેશ પટેલને જવાબ લેવા માટે બોલાવ્યા હતા, પરંતુ તે શરૂઆતમાં પોલીસમથકે આવ્યા નહોતા. ના છૂટકે તેમને શોધીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેણે સમગ્ર બાબતે કબૂલાત કરી છે. એટલું જ નહીં અરજદારની પત્ની વૈશાલીએ પણ પોલીસને જણાવ્યું છે કે, હિતેશ પટેલ શંકાશીલ સ્વભાવવાળો છે, જેના કારણે લગ્નજીવન દરમિયાન તે બંનેને વારંવાર ઝઘડા થતા હતા. દોઢ વર્ષ અગાઉ હિતેશ વૈશાલીને માર મારતાં તેણીને સખી હેલ્થ સેન્ટરમાં સારવાર લેવાની ફરજ પડી હતી.

પરિવારજનો દ્વારા પણ હિતેશને સ્વભાવ સુધારવા માટે અનેકવાર સમજાવ્યો હોવાનું અને પરિવારજનો પણ વૈશાલીના પક્ષમાં જ હોવાનું પણ એસ.પી. ગઢિયાએ જણાવ્યું છે. જોકે હિતેશ પટેલે પોલીસ સમક્ષ જે કબૂલાત કરી છે, તે અંગે ચર્ચા કરવા તેનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેણે ફોન રિસીવ કર્યા ન હતા.

દેશમાં 60...

છે જે સામાન્યથી બે ગણો છે. તહેવારની મોસમ પહેલા સ્ટોક ક્લિયર કરવા માટે બ્રાન્ડ ગ્રાહકોને લોભામણી ઓફર્સ પણ આપી રહી છે.

શુદ્ધતાના નામે...

પણ જણાયું કે પેકિંગમાં વેચાતા ગોળની સરખામણીમાં ખુલ્લો વેચાતો ગોળ વધુ ખરાબ છે. તેથી FSSAIએ પેકિંગવાળો ગોળ ખાવા સલાહ આપી છે.

■ દક્ષિણમાં સૌથી ઓછો નિયમભંગ: ગોળ બનાવતી વખતે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું સોથી વધુ ધ્યાન દ.ભારતમાં રખાય છે. ત્યાંનો 78.૩% ગોળ માપદંડો પર ખરો જણાયો જ્યારે ઉત્તર-પૂર્વમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું 59.4%, પશ્ચિમમાં 5૩.૩% અને ઉ.ભારતમાં સૌથી ઓછું 47.2% જ ધ્યાન રખાય છે.

પેજ-1નું અનુસંધાન

2 બુટલેગરોએ 6...

પદફારી સ્ટેટ મોનિટરીંગ સેલની તપાસમાં થયો છે. ગુજરાતના કુખ્યાત ગણાતા નાગદાન ગઢવી અને વિનોદ સિંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા દારૂના નેટવર્કમાં ઓંગડિયા પેઢીઓ મારફતે નાણાંનો હવાલો અપાતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે બન્નેના ઓંગડિયા દ્વારા કરાતા નાણાકીય વ્યવહારોની તપાસ કરતા કુલ 44 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બન્ને ઉપરાંત તેમના મળતિયાઓના 20 બેંક ખાતા સીઝ કર્યા છે. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી આ વ્યવહારો થયા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યુ છે. નાગદાન અને વિનોદ સિંધી પાર્ટનરશીપમાં દારૂનો ધંધો કરે છે. વડોદરાના કરજણ અને અમદાવાદના કણભા ખાતેના ગુનામાં બંન્નેની ધરપકડ કરાઈ હતી. બીજી તરફ, સ્ટેટ મોનીટરીંગ સેલે ગોવાથી નવાપુરામાં દારૂ લાવી ત્યાંથી ગુજરાતમાં સપ્લાય કરનારા બુટલેગરને મુંબઈથી પકડ્યો હતો. તેની તપાસમાં પણ દારૂના ધંધાનું ટર્નઓવર 200 કરોડથી વધુનું હોવાનું બહાર આવ્યું છે. આટલું જ નહીં તેના ફોન રેકૉર્ડમાં દક્ષિણ ગુજરાતના પોલીસ અધિકારીઓ સંપર્કમાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. મહિને બે કરોડનો હપતો આ બુટલેગર પોલીસને આપતો હોવાનું પણ તપાસમાં ખૂલ્યુ હોવાનું સુત્રોનું

કહેવુ છે.

32 ગુનામાં વોન્ટેડ નાગદાન ગઢવીનો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાશે

નાગદાન ગઢવીના મોબાઈલમાંથી દારૂની આયાત, વેચાણ અને વર્ડેચણી અંગેની વાતચીતની ઓડીયો કલીપ પણ મળી છે. જેમાં કોની કોની સાથે વાતચીત કરી છે તેની તપાસ માટે અને તે મેચ કરવા માટે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાશે.

દક્ષિણના 5...

તમિલનાડુ, આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં ચાલી રહેલી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંબંધિત મોટા ઈનપુટ મળ્યા છે. અહીં ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને અલ કાયદાએ પગપેસારો કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે કેરળ અને કર્ણાટમાં આ આતંકી સંગઠનોની હાજરીના અનેક કેસ સામે આવ્યા છે પણ તમિલનાડુ, આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં સક્રિય હોવાની માહિતી પહેલીવાર સામે આવી છે. અહીં અલગ અલગ ધાર્મિક તથા સામાજિક સંગઠનો સાથે જોડાયેલા લોકો બંને આતંકી સંગઠનો માટે સ્વીપર સેલનું કામ કરી રહ્યા છે. તેમની સાથે સંકળાયેલા લોકોને ખાડી દેશોથી ફિન્ડિંગ થઈ રહ્યું છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ નેતારુની હત્યામાં પીએફઆઈ અને એસડીપીઆઈની સંડોવણી હોવાની આરંકા વ્યક્ત કરી હતી.

આપણું...

સતત રોકાણ વધારીને બજારમાં ગ્રોથને યથાવત્ રાખી રહ્યા છે. આ ટ્રેન્ડ 8 વર્ષ પછી જોવા મળી રહ્યો છે. કોટક એએમસીના ડિરેક્ટર નીલેશ શાહ કહે છે કે હવે વિદેશી રોકાણકારો પણ ઓછી વેચવાલી કરવા લાગ્યા છે. બની શકે કે તે હવે ખરીદી પણ કરવા લાગે કેમ કે દુનિયાનાં બીજાં બજારોમાં તેમને સારો એવો ફાયદો મળતો નથી. એવામાં ભારતીય બજારમાં હજુ વધારે ઉછળો જોવા મળી શકે છે.

સૈન્ય પાછળના...

સૌથી વધુ 800,672 મિલિયન ડૉલરનો ખર્ચ કર્યો છે. બીજા ક્રમે 29૩,૩51 મિલિયન ડૉલર સાથે ચીન છે. જ્યારે 76,598 મિલિયન ડૉલરના ખર્ચ સાથે ભારત ત્રીજા ક્રમે છે. ભટ્ટે જણાવ્યું હતું કે સંરક્ષણ માટેનાં 50 ટકા ઉપકરણો 2017થી 2021 દરમિયાન આયાત કરવામાં આવ્યાં હતાં.

મુંબઈમાં ફિલ્મનો સેટ આગમાં ભસ્મીભૂત: એક યુવાનનું મોત



અંધેરીમાં ડીએન નગર, વીરા દેસાઈ રોડ ખાતે અંધેરી સ્પોર્ટ્સ ક્લબની પાછળ ચિત્રકૂટ મેદાનમાં શુક્રવારે સાંજે 4.30 વાગ્યે ફિલ્મનો સેટ આગમાં ભસ્મીભૂત થયો હતો. 200 બાય 25 ચોરસફૂટ જગ્યામાં આગ બુઝાવવા માટે અગ્નિશમન દળના 8 બંબાઓ, 1 પાણીનું ટેન્કર, 5 જમ્બો ટેન્કર મોકલવામાં આવ્યા હતા. આગને કારણે કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા સર્વત્ર છવાઈ ગયા હતા, જે દૂર દૂર સુધી દેખાતા હતા, જેને લીધે ભય ફેલાયો હતો. આગ રાત્રે 9.44 વાગ્યે કાબૂમાં આવી હતી. આગમાં દાંએલા મનીષ દેવાશી (૩0) નું મોત થયું હતું. ચિત્રકૂટમાં અનેક ફિલ્મ અને સિરિયલના નાના નાના સેટ ઊભા કરવામાં આવે છે. તેમાંથી જ એક સેટને આગ લાગી હતી. આગમાં કેટલું નુકસાન થયું અને ચોક્કસ કારણ શું છે તે તાત્કાલિક જાણી શકાયું નહોતું.

3૦ જૂન, ૨૦૨૨ ના અંતે પૂરા થતાં ત્રિમાસિકનો અનઓડિટેડ એકીકૃત નાણાંકીય પરિણામનો ઉતારો				
(રૂ. મિલિયનમાં શેર દીઠ વિગતો સિવાય)				
વિગતો	એકીકૃત			
	જૂન ૩૦, ૨૦૨૨	જૂન ૩૦, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૨	
	ત્રિમાસિક (અનઓડિટેડ)	ત્રિમાસિક (અનઓડિટેડ)	વાર્ષિકી (ઓડિટેડ)	
ઓપરેશન દ્વારા કુલ આવક				
ચોખ્ખો નફો / (નુકશાન) ત્રિમાસિક / વર્ષ માટે (કર, અસાધારણ અને / અથવા અસામાન્ય આઈટમો પહેલા)	૪,૯૪૦.૯૭	૩,૦૪૨.૫૭	૧૭,૬૮૫.૪૨	
ચોખ્ખો નફો / (નુકશાન) ત્રિમાસિક / વર્ષ માટે કર પહેલા (અસાધારણ અને / અથવા અસામાન્ય આઈટમો પછી)	૪૨૦.૭૯	૨૮૨.૧૨	૧,૯૪૬.૫૩	
ચોખ્ખો નફો / (નુકશાન) ત્રિમાસિક / વર્ષ માટે (કર, અસાધારણ અને / અથવા અસામાન્ય આઈટમો પછી)	૩૧૦.૭૯	૨૮૨.૧૨	૧,૯૪૬.૫૩	
કુલ વ્યાપક આવક / (નુકશાન) ત્રિમાસિક / વર્ષ માટે				
(સમાવિષ્ટ નહો (કર બાદ) અને અન્ય વ્યાપક આવક (કર પછી) ત્રિમાસિક / વર્ષ માટે)	૩૧૦.૦૦	(૨૨૨.૫૩)	૧,૩૫૧.૧૧	
પેઈડ-અપ ઈક્વિટી શેર કેપિટલ (ફિસ વેલ્યુ રૂ. 1૦/- દરેક, કુલથી પેઈડ)	૧,૭૭૧.૨૪	૧,૭૪૮.૬૨	૧,૭૭૦.૫૭	
અન્ય ઈક્વિટી આવક શેર દીઠ (રૂ. 1૦ દરેક)			૧૭,૦૫૩.૬૯	
- બેંકિંગ	૧.૭૫	(૧.૨૭)	૮.૨૧	
- હાઉસિંગ	૧.૭૪	(૧.૨૬)	૮.૦૮	

નોંધ:

૧) ૨૮ જુલાઈ, ૨૦૨૨ ની સંબંધિત મિટીંગમાં ઉપરોક્ત પરિણામની ઓડિટ કમિટીએ સમીક્ષા કરી અને બોર્ડ ડિરેક્ટરોએ અહાલી આપી. ઓડિટર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલમાં કોઈ ક્વોલિફિકેશન નથી.

૨) ૩૦ જૂન, ૨૦૨૨ ના અંતે પુરા થતાં ત્રિમાસિકના અંતે અનઓડિટેડ નાણાકીય પરિણામનો ઉતારો (એકલ આધારે)

(રૂ. મિલિયનમાં)				
વિગતો	જૂન ૩૦, ૨૦૨૨	જૂન ૩૦, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૨	
	ત્રિમાસિક (અનઓડિટેડ)	ત્રિમાસિક (અનઓડિટેડ)	વાર્ષિકી (ઓડિટેડ)	
કુલ આવક ઓપરેશનથી	૪,૮૪૦.૮૭	૩,૦૪૨.૫૬	૧૭,૬૮૫.૪૨	
નફો કર પહેલા ત્રિમાસિક / વર્ષ માટે	૪૨૦.૭૨	૨૮૧.૯૩	૧,૯૪૫.૧૫	
નફો કર બાદ ત્રિમાસિક / વર્ષ માટે	૩૦૯.૮૭	(૨૨૨.૩૪)	૧,૪૨૪.૪૧	

૩) ૨૮ જુલાઈ, ૨૦૨૨ ના રોજ યોજાયેલ બોર્ડ ઓફ ડાયરેક્ટરોની મિટીંગમાં રૂ. ૧૦ ના દરેક દીઠ ફેશ વેલ્યુના ઈક્વિટી શેર માટે વચગાળાનું ડિવિડન્ડ રૂ. ૩/- જાહેર કરવામાં આવ્યું છે.

કંપની દ્વારા જાહેર થનાર રેકૉર્ડ તારીખે તમામ યોગ્ય શેર હોલ્ડરને તેની ચક્રવર્ણી થશે.

૪) આવકવેરા વિભાગે આવકવેરા કાયદો 1૯૬૧ ની કલમ 1૩૨ હેઠળ કંપનીના વિવિધ બિઝનેસ પરિસરમાં જુલાઈ ૨૦૨૧માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ દરમ્યાન કંપનીએ આવકવેરા અધિકારીઓને પૂરતો સહકાર આપી અને તેમના દ્વારા માંગવામાં આવેલ તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી. સેબી (એલઓડીઆર) નિયમન, ૨૦૧૫ (સુધારેલ તરીકે) નિયમ ૩૦ મુજબ કંપનીએ ૨૩ જુલાઈ ૨૦૨૧ ના આ સંબંધમાં સ્ટોક એક્સચેન્જમાં જરૂરી ખુલાસો કર્યો હતો. આ નાણાકીય પરિણામો જાહેર કરવાની તારીખે, આવકવેરા વિભાગ તરફથી તેમની તપાસ / મુલ્યાંકન નિષ્કર્ષ અંગે કંપનીને કોઈ ઓપચારિક વિગતો પ્રાપ્ત થઈ નથી. આકારણી વર્ષ ૨૦૧૮-1૯ થી ૨૦૨૧-૨૨ માટે આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૧૪૮ અને / અથવા કલમ ૧૪૩(૨) હેઠળની નોટિસ સિવાય કે જેના માટે કંપનીએ જવાબ આપ્યો છે / નોટીસનો જવાબ આપવાની પ્રક્રિયામાં છે. મેનેજમેન્ટનું માનવું છે કે ૩૦ જૂન, ૨૦૨૨ ના રોજ કંપનીની નાણાકીય સ્થિતિ અને સમાપ્ત થયેલ ત્રિમાસિક અંતની તારીખે કામગીરી પર આની કોઈ અસર થશે નહીં અને તેથી આ નાણાકીય પરિણામોમાં કોઈ જવાબદારી માટે કોઈ જોગવાઈને માન્યતા આપવામાં આવી નથી.

ઉપરોક્ત ૩૦ જૂન, ૨૦૨૨ના ત્રિમાસિકના અંતે પુરા થતાં અનઓડિટેડ એકલ અને એકીકૃત નાણાકીય પરિણામનો ઉતારો છે જેને સિસ્ક્રિપ્ટરી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (જવાબદારી અને જરૂરિયાતની યાદી) નિયમન ૨૦૧૫ના નિયમ ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જમાં રજૂ કર્યો છે. આ પરિણામની સંપૂર્ણ વિગતો સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com, www.nseindia.com અને કંપનીની વેબસાઈટ www.dbcorppltd.com ઉપર ઉપલબ્ધ છે.

સ્થળ: મુંબઈ
તારીખ: જુલાઈ ૨૮, ૨૦૨૨
ડી.બી. કોર્પ લિમિટેડ - રજીસ્ટર્ડ કાર્યાલય: પ્લોટ નં. ૨૮૦, સરખેજ - ગાંધીનગર હાઉંગ, વાયએમસીએ ક્લબ પાસે, મકરભા, અમદાવાદ - ૩૮૦૦૫૧, ગુજરાત
ટેલી. નં.: ૦૨૨-૭૭૧૭૦૦૦૦ • ઈ-મેલ: dbcs@dbcorp.in • વેબસાઈટ: www.dbcorppltd.com • સીઆઈએન નં.: L22210GJ1995PLC047208

દિવ્ય ભાસ્કર

Social Leader of Kathlal & Kapadvanj

રાજેશકુમાર એમ. પટેલ

સામાજિક આગેવાન, ગામ: ભાટેરા તા; કઠલાલ જી: ખેડા



રાજેશ પટેલે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરેલ છે. ત્યારબાદ તેઓ ૧૯૮૮ થી લઈને ૨૦૦૫ સુધી વિવિધ ક્ષેત્રોમાં અનેક વ્યવસાયોમાં ઉચ્ચ સ્થાન પર રહીને પોતાની કારકિર્દી બનાવી છે.

એક ઉચ્ચ અભ્યાસ ધરાવતા હોવા છતાં તેઓ સરળ સ્વભાવના માનવી છે, હંમેશા લોકોનું કલ્યાણ થાય લોકોનું ભલું થાય એજ પરોપકારની ભાવના તેમનામાં ભરેલી છે. આજે તેઓ ચરોતરમાં વ્યવસાય તેમજ ખેતીની સાથે-સાથે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ ભજવે છે. ચરોતરમાં કોઈ હોનારત હોય કે પ્રજાલક્ષી કે સમાજલક્ષી કોઈ પ્રશ્નો હોય તે હંમેશા લોકોની વચ્ચે જોવા મળી રહ્યા છે. અને પ્રજાના પ્રશ્નોનું ઉચ્ચસ્તરીયે રજૂઆત કરીને તેનું નિરાકરણ સરળતાથી લાવી રહ્યા છે.

હાલમાં રાજેશ પટેલ કપડવંજના પ્રભારી તરીકેની જવાબદારી સોપેલ છે જેમા તે તનતોડ મહેનત કરી રહ્યા છે .

ભાટેરાના પૂર્વ સરપંચ , આદર્શ ગામ બનાવનાર તેમજ ગામને આધુનિક સુવિધાથી સજ્જ કરનાર રાજેશ પટેલના પત્ની હાલમાં ભાટેરા ગામના સરપંચ તરીકે તેમની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાભાવથી નિભાવી રહ્યાં છે .

ભાજપ સંગઠન દ્વારા તેમના જિલ્લામાં વિવિધ પ્રકારની જવાબદારી આ વર્ષે તેમને સોંપવામાં આવી. જેમ કે ટિક્કિન બેઠક ઈન્ચાર્જ, જિલ્લાના વિસ્તારક વાલી તરીકેની જવાબદારી હોય કે પછી કોઈ જગ્યાના ગુજરાતમાં બાય ઈલેક્શન અથવા ગુજરાત બાહરની ચુંટણીમાં કોઈક વિધાનસભાની જવાબદારી. દરેક જવાબદારીમાં તેઓ એક કર્મઠ સંગઠનના કાર્યકર તરીકે સેવા બજાવી રહ્યા છે .



• સંજીવ ચૌહાણ (સીઓઓ, દિવ્યભાસ્કર), દેવુસિંહ ચૌહાણ (કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી, ભારત સરકાર) અને ગોર ગોપાલ દાસ (મોટિવેશનલ સ્પીકર)ના હસ્તે લિજેન્ડ્સ ઓફ ગુજરાત એવોર્ડ-2022 સ્વીકારતા રાજેશકુમાર પટેલ

રાજેશ પટેલની રાજકીય કારકિર્દીની શરૂઆત



- તેઓ વર્ષ ૨૦૦૫થી ભારતીય જનતા પાર્ટીમાં વડોદરા શહેરમાંથી સામાન્ય કાર્યકર તરીકે જોડાયા હતા.
- તેઓને વર્ષ ૨૦૧૬માં ભાટેરાના ગ્રામજનોએ ગામના સરપંચ તરીકે ભારે બહુમતીથી ચૂંટી કાઢ્યા હતા.
- ત્યારબાદ સરપંચ તરીકેની જવબદારીને બહુ સારી રીતે નિભાવતા જોઈને ભારતીય જનતા પાર્ટીએ સરપંચના એ વર્ષના સમયગાળામાં ૨૦૧૭માં ભારતીય જનતા પાર્ટીમાં કઠલાલ તાલુકાના કિશાન મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી તેમને સોંપી હતી..
- ખૂબ જ સારી રીતે કિશાન મોરચાની કામગીરી કરવાથી પાર્ટીએ ખેડા જિલ્લાની સંગઠન મંત્રી તરીકેની વધુ એક જવાબદારી તેમને સોંપી હતી.
- વર્ષ ૨૦૧૮માં માતર અને ખેડાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી જેમાં તેઓએ સારું કાર્ય કરેલ હતું.
- વર્ષ ૨૦૨૧માં ફરીથી જિલ્લા મંત્રી તરીકેની જવબદારી તેમને આપવામાં આવી હતી ત્યારે તેઓનો પ્રથમ ધ્યેય સંગઠનને વધુ મજબૂત કરવાનો છે.
- વર્ષ ૨૦૨૧માં ફરીથી ભાટેરા ગામના સરપંચ તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા.
- ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે 5555 (પાંચ હજાર પાંચસો પંચાવન) વૃક્ષો વાવી તેના ઉછેરનો સંકલ્પ કરેલ છે.
- કઠલાલ-કપડવંજના 22000 જેટલા વિદ્યાર્થીઓના પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાનું 5 વર્ષનું પ્રીમિયમ ભરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે
- વિશ્વ યોગ દિવસ નિમિત્તે 'ફિટ ઈન્ડિયા'ના મંત્રને સાર્થક કરતા 1000 જેટલા યુવાનોને યોગામેટ આપી યોગ માટે પ્રોત્સાહિત કર્યા

MPS LIMITED

Registered Office: 4th Floor, R.R Towers IV, Super A, 16/17, T.V.K. Industrial Estate, Guindy, Chennai 600 032
CIN: L22122TN1979PLC005795
Tel: +91 44 49162222, Fax: +91 44 49162225, Email: investors@mpslimited.com, Website: www.mpslimited.com

Extract of unaudited consolidated financial results for the quarter ended 30 June 2022

Particulars	INR in lacs, except per equity share data		
	Quarter ended 30-June-2022	Corresponding quarter ended in the previous year 30-June-2021	Current year ended 31-March-2022
Total Income from operations	11,485	11,715	44,888
Net Profit for the period before tax	2,808	2,882	11,796
Net Profit for the period after tax	2,064	2,141	8,712
Total Comprehensive Income for the period	2,473	2,342	9,133
Equity Share Capital	1,711	1,805	1,711
Earnings Per Share (INR 10 per equity share)			
Basic and diluted	12.07	11.86	48.61

Key data relating to unaudited standalone financial results for the quarter ended 30 June 2022

Particulars	INR in lacs		
	Quarter ended 30-June-2022	Corresponding quarter ended in the previous year 30-June-2021	Current year ended 31-March-2022
Total Income from operations	6,891	7,410	28,402
Net Profit for the period before tax	2,180	2,427	9,839
Net Profit for the period after tax	1,595	1,759	7,146
Total Comprehensive Income	1,733	1,771	7,286

Notes:

- The above standalone and consolidated unaudited financial results for the quarter ended 30 June 2022 have been approved by the Board of Directors of the Company at their meeting held on 28 July 2022. The Statutory Auditors of the Company have carried out limited review of the financial results for the quarter ended 30 June 2022 and an unmodified review report has been issued.
- The above is an extract of the detailed format of standalone and consolidated unaudited financial results for the quarter ended 30 June 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the standalone and consolidated unaudited financial results for the quarter ended 30 June 2022 are available on the Stock Exchanges websites (www.bseindia.com) and Company's website (www.mpslimited.com).

Place: Noida
Date: 28 July 2022

For MPS Limited
Sd/-
Rahul Arora
Chairman and Managing Director

indianexpress.com

The Indian EXPRESS
— JOURNALISM OF COURAGE —

I choose substance over sensation.
Inform your opinion with credible journalism.



The Indian Express.
For the Indian Intelligent.

DELHI JAL BOARD : GOVERNMENT OF N.C.T. OF DELHI
OFFICE OF THE ADDITIONAL CHIEF ENGINEER (M-1)
E-EXECUTIVE ENGINEER (M)-62 / T-2
E-BLOCK PARK : PREET VIHAR : DELHI-110092
Phone No. 22502206, Mail ID:- djbceastii@gmail.com

PRESS NOT NO. 23(2022-23)

Sr. No.	Name of Work	Amount Payable to Tender	Amount Received	Tender No. & Date of Receipt of Tender	Last Date of Receipt of Tender
1.	Replacement of old damaged 300 mm dia sewer line at H. No. 127 to 140, 68, S-Block Swasthya Vihar, in 20 E Ward Under EE (M)-55.	36,08,672.00	600.00	2022-DJB-226862-1	06-Aug-22 02:00 PM
2.	Replacement and rectification - damaged 100 mm dia sewer line to avoid contamination of 628 to 302, 301, No. 3 and 2 and 4 East Laxmi Market in 205 Ward in AC-59, EE(M)-59.	38,50,447.00	600.00	2022-DJB-226862-2	06-Aug-22 02:00 PM
3.	Replacement of old damaged sewer line in Gali No.-01 Shyam Nagar by steel pipe having method in ward no. 235 in AC-60 under ACE (M)-1.	500.00	61,000.00	2022-DJB-226862-3	06-Aug-22 02:00 PM

* Further details in this regard can be seen at <https://govtprocurement.delhi.gov.in>

ISSUED BY PRO (WATER)
Advt. No. J.S.W. 264 (2022-23)

Sd/-
SUDHIR KUMAR GUPTA
EX. ENGINEER (M)-62 (T-2)

STOP CORONA: Wear Mask, Follow Physical Distancing, Maintain Hand Hygiene

Satin Housing Finance Limited
CIN: U55290DL2017PLC316143 Corp. Office: Plot No. 462, 2nd Floor, B Wing, Udyog Vihar, Phase - II, Gurugram, Haryana 122016, Regd. Office: 5th Floor, Kundan Bhawan, Azadpur Commercial Complex, Azadpur, New Delhi-110033 Email Id: compliance@satinhousingfinance.com | CIN: 0124-4346200

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022 (IN Lakhs except EPS)

	Qtr ended June 30, 2022	Qtr ended June 30, 2021	Previous year ended March 31, 2022
1. Total Income from Operations	Unaudited 1,175.81	Unaudited 943.03	Audited 1,354.31
2. Net Profit for the period (before Tax, and Exceptional Items)	43.98	61.70	426.09
3. Net Profit for the period before tax (after Exceptional Items)	43.98	61.70	426.09
4. Net Profit for the period after tax (after Exceptional Items)	33.14	45.42	303.76
5. Total Comprehensive Income for the period	37.43	45.42	303.94
Income (after tax)			
6. Paid up Equity Share Capital	10,000.00	9,500.00	10,000.00
7. Reserves (excluding Revaluation Reserve)	-	-	123.87
8. Securities Premium Account	Nil	Nil	Nil
9. Net worth	-	-	10,123.87
10. Paid up Debt Capital / Outstanding Debt	-	-	20,975.67
11. Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil
12. Debt Equity Ratio	2.20	1.34	2.07
Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -			
*EPS for the Three months not annualised			
1. Basic:	0.03*	0.05*	0.31
2. Diluted:	0.03*	0.05*	0.31
14. Capital Redemption Reserve	Nil	Nil	Nil
15. Debenture Redemption Reserve	Nil	Nil	Nil
16. Debt Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable
17. Interest Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable

Notes: 1. The above is an extract of the detailed format of quarterly/ half yearly financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the quarter ended June 30, 2022 are available on the website of the Company i.e. www.satinhousingfinance.com and on the websites of the Stock Exchanges i.e. www.bseindia.com. 2. For the items referred in Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made by the BSE and also made available on the website of the Company i.e. www.satinhousingfinance.com. 3. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of Satin Housing Finance Limited (The Company) at their meetings held on July 28, 2022.

Place: Gurugram
Date: July 28, 2022

For Satin Housing Finance Limited
Sd/- Anil Sharma Managing Director & CEO DIN No. 08050304

THE WATERBASE LIMITED
Regd Office : Ananthapuram Village P D Gur Mandal, Nellore, Andhra Pradesh -524 344. Ph: +91-9100018037
E-mail : investor@waterbaseindia.com | Website : www.waterbaseindia.com | CIN : L05005AP1987PLC018436

Extract of Unaudited Consolidated Financial Results for the quarter ended June 30, 2022 (Rs. in Lakhs except for per share data)

S.No	Particulars	Quarter ended			Year ended
		Jun 30, 2022	Mar 31, 2022	Jun 30, 2021	Mar 31, 2022
		Unaudited	Unaudited	Unaudited	Audited
1.	Total Income	8,039.49	3,919.48	12,674.01	30,132.95
2.	Net profit before Tax and exceptional items	83.43	(814.12)	1,020.61	33.77
3.	Net profit before Tax and after exceptional items	83.43	(814.12)	1,020.61	33.77
4.	Net profit after tax and exceptional items	60.49	(620.37)	755.96	7.79
5.	Total Comprehensive Income (after tax)	61.04	(622.73)	755.96	9.71
6.	Equity share capital (Face value of Rs.10/- per equity share)	4,142.68	4,142.68	4,142.68	4,142.68
7.	Other equity	-	-	-	-
8.	Earnings Per share (of Rs.10/- each)				
(a) Basic:		0.15	(1.50)	1.84	0.02
(b) Diluted:		0.15	(1.50)	1.84	0.02

Notes:

- The above results were reviewed and recommended by the Audit committee and approved by the Board of Directors at their respective meetings held on July 27, 2022.
- Additional information on unaudited standalone financial results for the quarter ended June 30, 2022 is as follows:

Particulars	Quarter ended			Year ended
	Jun 30, 2022	Mar 31, 2022	Jun 30, 2021	Mar 31, 2022
	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Income	8,039.49	3,919.48	12,674.01	30,132.95
Net profit before Tax and exceptional items	83.43	(812.59)	1,020.67	36.04
Net profit before Tax and after exceptional items	83.43	(812.59)	1,020.67	36.04
Net profit after tax and exceptional items	60.90	(618.84)	755.96	9.76
Total Comprehensive Income (after tax)	61.45	(621.20)	755.92	11.98

3. The above is an extract of the detailed format of standalone and consolidated financial results for the quarter ended June 30, 2022 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the website of Stock Exchange www.bseindia.com and also on the Company's website www.waterbaseindia.com

On behalf of Board of Directors
Varun Aditya Thapar
Director
DIN: 02322660

STEP TWO CORPORATION LIMITED

Registered Office: 21, Hemanta Basu, Sector, 5th Floor, Room No.007, PS, New Street Kolkata-700013, West Bengal, India.
Contact Number : +91 9332318007, Email Address: admin@steptwo.in | Website: www.steptwo.in

Recommendations of the Committee of Independent Directors of Step Two Corporation Limited (STEP2CO or Target Company) on the Offer made by Mr. Anuj Agarwal (Acquirer) to the Public Shareholders of the Target Company in accordance with the provisions of Regulation 52 of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011 including subsequent amendments therein (SEBI (SAST) Regulations).

Sl. No.	Particulars	Quarter ended			Year ended
		Jun 30, 2022	Mar 31, 2022	Jun 30, 2021	Mar 31, 2022
		Unaudited	Unaudited	Unaudited	Audited
1.	Total Income	8,039.49	3,919.48	12,674.01	30,132.95
2.	Net profit before Tax and exceptional items	83.43	(814.12)	1,020.61	33.77
3.	Net profit before Tax and after exceptional items	83.43	(814.12)	1,020.61	33.77
4.	Net profit after tax and exceptional items	60.49	(620.37)	755.96	7.79
5.	Total Comprehensive Income (after tax)	61.04	(622.73)	755.96	9.71
6.	Equity share capital (Face value of Rs.10/- per equity share)	4,142.68	4,142.68	4,142.68	4,142.68
7.	Other equity	-	-	-	-
8.	Earnings Per share (of Rs.10/- each)				
(a) Basic:		0.15	(1.50)	1.84	0.02
(b) Diluted:		0.15	(1.50)	1.84	0.02

Notes:

- The above results were reviewed and recommended by the Audit committee and approved by the Board of Directors at their respective meetings held on July 27, 2022.
- Additional information on unaudited standalone financial results for the quarter ended June 30, 2022 is as follows:

On behalf of Board of Directors
Varun Aditya Thapar
Director
DIN: 02322660

SHRIRAM TRANSPORT FINANCE COMPANY LIMITED

CIN: L65191TN1979PLC007874
Regd. Office: Sri Towers, 14A, South Phase, Industrial Estate, Guindy, Chennai - 600 032, Tamil Nadu.
Tel No: +91 44 4852 4666, Fax: +91 44 4852 5666, Website: www.stfc.in, email: secretarial@stfc.in

Extract of Unaudited Financial Results for the Quarter ended June 30, 2022 (IN IN crores)

Sr. No.	Particulars	Standalone			Consolidated		
		Quarter Ended 30.06.2022 (Unaudited)	30.06.2021 (Unaudited)	Year Ended 31.03.2022 (Audited)	Quarter Ended 30.06.2021 (Unaudited)	30.06.2021 (Unaudited)	Year Ended 31.03.2022 (Audited)
1.	Total income from operations	5,145	4,648	19,255	5,145	4,648	19,255
2.	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1,307	235	3,549	1,307	235	3,549
3.	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1,307	235	3,549	1,307	235	3,549
4.	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	965	170	2,708	965	170	2,708
5.	Net Profit for the period after tax, minority interest and share of profit/(loss) of associate (after tax)	NA	NA	NA	967	170	2,721
6.	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	883	158	2,585	884	158	2,598
7.	Paid-up equity share capital	271	267	271	271	267	271
8.	Reserves (excluding Revaluation Reserve)	26,545	23,289	25,662	26,708	23,437	25,824
9.	Securities Premium Account	5,662	5,177	5,662	NA	NA	NA
10.	Net worth	26,788	23,528	25,905	NA	NA	NA
11.	Paid up Debt Capital/Outstanding Debt	NA	NA	NA	NA	NA	NA
12.	Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil	NA	NA	NA
13.	Debt Equity Ratio	4.45	4.47	4.42	NA	NA	NA
14.	Earnings per share (before and after extraordinary items) (of ₹ 10/- each) (after tax)						
(a) Basic (₹)		35.68	6.64	101.74	35.73	6.63	102.23
(b) Diluted (₹)		35.68	6.64	101.74	35.73	6.63	102.23
15.	Capital Redemption Reserve	54	54	54	NA	NA	NA
16.	Debt Service Coverage Ratio	307	921	307	NA	NA	NA
17.	Debt Service Coverage Ratio	NA	NA	NA	NA	NA	NA
18.	Interest Service Coverage Ratio	NA	NA	NA	NA	NA	NA

Notes:

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 52 (8) read with Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the stock exchange websites: www.bseindia.com, www.nseindia.com and company's website: www.stfc.in.

Place : Mumbai
Date : July 28, 2022

By order of the Board
For Shriram Transport Finance Company Limited
Umesh Revankar
Vice Chairman & Managing Director
DIN : 00141189

Place: Kolkata
Date: Thursday, July 28, 2022

For and on behalf of
Committee of Independent Directors
Step Two Corporation Limited
Sd/-
Mr. Sanjay Agarwal
(Chairman of IDC)